



# Bharat Parenterals Limited

**Registered Office & Works:**

Survey No.: 144-A, Jarod-Samlaya Road, Vill. Haripura,

Ta. Savli, Dist. Vadodara - 391520 (Guj.) India.

Mobile : 99099 28332

E-mail: info@bplindia.in, Web.: www.bplindia.in

CIN NO: L24231GJ1992PLC018237

(WHO-GMP CERTIFIED ★ STAR EXPORT HOUSE)

**Date: 15<sup>th</sup> February, 2023**

To,  
BSE Limited,  
P.J. Towers,  
Dalal Street,  
Mumbai – 400001

Ref.: Company Code: 541096

Dear Sir / Madam

**Sub: Regulations 30 and 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015**

Please find enclosed extracts of the newspaper publications published in Business Standard and Loksatta Jansattta on 14<sup>th</sup> February, 2023, relating to the Un-Audited Standalone and Consolidated Financial Results for the for the quarter ended on 31<sup>st</sup> December, 2022.

Request you to please take the same on record.

Thanking You,

**FOR BHARAT PARENTERALS LIMITED**

**Shyam Singh Rajpurohit**  
Company Secretary



### Bharat Parenterals Limited

CIN No. L24231G199291216227

Registered Office & Works:  
VIII, Hanurata, Ta. Savli, Dist. Gandhinagar, Gujarat-382001  
Tel : (02687) 251679, 251680, 251689, 96009 28332  
E-mail: info@bplindia.in, Web: www.bplindia.in  
(WHO-CAMP CERTIFIED - STAR EXPORT HOUSE)

#### EXTRACT OF UNAUDITED FINANCIAL RESULT FOR THE QUARTER AND HALF YEAR ENDED 31st DECEMBER, 2022

(Rs. in lakhs)

Sl. No.	Particulars	STANDALONE			CONSOLIDATED			Year Ended 31.03.2022 (Audited)
		Quarter Ended 31.12.2022 (Unaudited)	Quarter Ended 30.09.2022 (Unaudited)	Quarter Ended 31.12.2021 (Unaudited)	Quarter Ended 30.09.2021 (Unaudited)	Quarter Ended 31.12.2021 (Unaudited)	Quarter Ended 30.09.2021 (Unaudited)	
1.	Total Income from operations (net)	5902	8190	3846	5902	8190	3846	21201
2.	Net Profit for the period before tax	524	1394	235	524	1394	235	2788
3.	Net Profit for the period after tax	361	999	145	361	999	145	2081
4.	Total Comprehensive Income for the period	577.466	577.466	577.466	577.466	577.466	577.466	577.466
5.	Equity Share Capital	577.466	577.466	577.466	577.466	577.466	577.466	577.466
6.	EPS Basic & Diluted	6.60	17.30	2.55	6.60	17.30	2.55	36.87

**NOTE:**  
1) The above Results has been reviewed by Statutory Auditors, recommended by Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on 17<sup>th</sup> February, 2023.  
2) This is an extract of the detailed format of quarterly/financial results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full form of the financial results for the quarter and half year ended 31st December, 2022 are available on the websites of the stock exchange www.bseindia.com and also on Company's Website www.bplindia.in

By order of the Board  
Bharat Parenterals Limited  
Sd/-  
BHARAT PATEL  
Managing Director

Place : Vadodra  
Date : 13th February, 2023

### PPGCL

PRAJAPATI POWER GENERATION COMPANY LIMITED

Regd. Office: Shabadi Bhawan, B12 & 13, Sector 4, Sanam Baha Nagar, Noida, Uttar Pradesh-201301  
Plant Address: PO - Lohra, Tahsil-Bara Prayagraj (Ahamadabad), Uttar Pradesh-212107  
Phone : +91-120-6102000/6102009 (CN: U40101UP2007PLC032835)

#### NOTICE INVITING EXPRESSION OF INTEREST

**Prayagraj Power Generation Company Limited** has invited expression of Interest (EOI) from eligible vendors for **"SALE OF DRY FLY ASH & CONDITIONED FLY ASH VIA RAIL & ROAD MODE"** from 3 x 660 MW Prayagraj Thermal Power Plant located at Bara Site, Dist. Prayagraj, Uttar Pradesh, India.

TENDER REFERENCE NO.: CC-FY23-AYV-PPGCL-Ash Logistics-Feb 23

Details of pre-qualification requirements, bid security, purchasing of tender document etc. may be downloaded using the URL - <https://www.tatapower.com/tender/tenderid.asp>. Eligible vendors willing to participate may submit their expression of interest along with the tender fee for issue of bid document latest by 24/02/2023.

#### APPENDIX IV

[See rule 8 (1)]  
**POSSESSION NOTICE**  
(For immovable property)

Whereas, The undersigned being the Authorized Officer of **INDIABULLS HOUSING FINANCE LIMITED (CIN: L65922DL2005PLC136029)** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued in the name of the said Borrower, the undersigned hereby gives notice to the Borrower that the Borrower has defaulted in repayment of the loan account No. **HLSRMM00503549** as on 16.11.2022 and interest thereon within 60 days from the date of receipt of the said Notice.

The Borrower(s) having failed to repay the amount, Notice is hereby given to the Borrower(s) and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on **08.02.2023**.

The Borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **INDIABULLS HOUSING FINANCE LIMITED** for an amount of **Rs. 27,78,278.72 (Rupees Twenty Seven Lakhs Seven Thousand Eight Hundred Twenty Seven Eight and Paise Seventy Two Only)** against Loan Account No. **HLSRMM00503549** as on 16.11.2022 and interest thereon within 60 days from the date of receipt of the said Notice.

The Borrower's attention is invited to provisions of Sub-Section (8) of Section 13 of the Act in respect of time available, to redeem the Secured Assets.

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

ALL THAT PIECES OR PARCELS OF LAND AS UNDER TOGETHER WITH ALL THE STRUCTURES, BUILDINGS, FURNITURE, FITTINGS, FITTINGS, STANDING AND/OR PLANT AND MACHINERY INSTALLED TO BE INSTALLED AND/OR CONSTRUCTED/ TO BE CONSTRUCTED THEREON AND ALL THE PRESENT AND FUTURE TITLE, INTERESTS AND/OR RIGHTS OF THE MORTGAGOR(S) THEREIN:  
IMMOVABLE PROPERTY, PREMISES OF PLOT NO. 26, (AFTER J. P. DURASTI) BLOCK NO. 145-26 MEASURING 116.07 SQUARE METERS, OPEN PLOT, ALONGWITH PROPORTIONATE UNDIVIDED SHARE IN INTERNAL ROAD & COP ADMEASURING 53.55 SQUARE METERS, "CASAH HOMES" DEVELOPED UPON LAND SITUATED IN STATE OF GUJARAT, DISTRICT SURAT, SUB-DISTRICT TALUKA PALSANA, MOJI VILLAGE SURAT, BLOCK NO. 145, OLD REVENUE SURVEY NO. 128, HECTARE-ARE 0.74-87 SQUARE METERS I.E. 7487 SQUARE METERS, N.A. LAND PAKKE, SURAT-39410, GUJARAT.  
FOUR BOUNDARIES OF THE PROPERTY:  
EAST : SOCIETY INTERNAL ROAD WEST : BLOCK NO. 145 PROPERTY NORTH : PLOT NO. 27 PROPERTY SOUTH : PLOT NO. 24 PROPERTY

Sd/-  
Authorized Officer  
**INDIABULLS HOUSING FINANCE LIMITED**

### Indian Overseas Bank - Anand Branch

NOTICE FOR CHANGE OF LOCATION

All respected customers are informed that our above branch will be shifted from **Date: 10.04.2023** to its new premises at **Shop no- 5, 6 M.S. Plaza Showroom, Near MB Patel college Anand District Anand Gujarat -388001**

The customer service point will remain open until the migration is complete. All customers are requested to take advantage of banking services in the new building.

Date: 14.02.2023 Branch Manager - Anand Branch

### GSPCL India Gasnet Limited

CIN: L40201G12018GC007449 Corp. Office: GSPCL Bhawan, Sector-28, Gandhinagar-382 028 Tel: +91-79-2628550 Fax: +91-79-2328555 Website: www.gspcgroup.com

#### NOTICE INVITING TENDER

GSPCL India Gasnet Limited (GIGL), Joint venture Company promoted by GSPCL, IOCL, BPCIL and HCL is laying a gas grid, to facilitate gas transmission from supply points to demand centres. GIGL invites bids from reputed pipeline construction companies for the following requirements:-

**Tender Pipeline and Associated Works for HRRL Connectivity Project (18" X 85 Km approx.) on EPC basis.**

Interested bidders can view/download details, viz. Bidding Schedule, Bid Qualification Criteria (BQC) and other details from <http://giglprocure.com>. Details can also be viewed on GIGL website (<http://gspcgroup.com>).

Bidders can submit their bid through <http://giglprocure.com> and all future announcement related to this tender shall be published on <http://giglprocure.com> only.

GIGL reserves the right to cancel and/or alter bidding process at any stage without assigning any reason. GIGL also reserves the right to reject any or all of the bids received at its discretion, without assigning any reasons whatsoever.

### HERO HOUSING FINANCE LIMITED

Regd. Office: G9, Community Centre, Bassant Lok, Vasant Vihar, New Delhi - 110057  
Phone: 911 49267900, Toll Free Number: 1600 212 2000, Email: customer.care@herohero.com  
Website: [www.herohousingfinance.com](http://www.herohousingfinance.com) (CIN: U65192DL2019PLC039145)  
Contact Address: 309, Third Floor, Nishal Centre, Near Nishal Circle, P. No. Road, P. Adajan, Surat - 392001

#### POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002) Whereas, the undersigned being the Authorized Officer of the Hero Housing Finance Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice as mentioned below calling upon the Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of the said notice. The borrower, having failed to repay the amount, notice is hereby given to the borrower in particular and the public in general, that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under section 13(4) of the said Act read with rule 8 of the said Rules.

The borrower, in particular, and the public in general, are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Hero Housing Finance Limited, for an amount referred to below along with interest thereon and penal interest, charges, costs, etc. as mentioned below.

The borrower's attention is invited to provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Loan Account No.	Name of Obligor(s)/ Legal Heir(s)/Legal Representative(s)	Date of Demand Notice/Amount as per Demand Notice	Date of Possession (Constructive/ Physical)
HHFVAPLAP 21000016216	Mr. Hari Babu Son Of Gopichand, Mr. Devali Nandan Son Of Hari Babu & Mrs. Radha Govind Son Of Hari Babu	19/10/2022 Rs. 13,48,786/- as on date 18/10/2022	11/02/2023 (Symbolic)
HHFVAPLAP 21000016223	Mrs. Pooja Devi Wife Of Radha Govind	19/10/2022	11/02/2023 (Symbolic)

**Description of Secured Assets/Immovable Properties:** All that piece and parcel Shop No. 01, Admeasuring about 285.00 Sq. Mtrs. lying and located on the Ground Floor of the Building known as "APPLE APARTMENT" Constructed on the N.A. land bearing Plot No. 39, admeasuring about 1087.00 Sq. Mtrs. bearing Revenue Survey No. 200-291, Pakee bearing City Survey No. 17, Situated within the Village Limits of Vapi/Nagarapalka, Vapi, Tal. Vapi, Dist. Valsad, Gujarat-396111. With common amenities written in Title Document. Bounded by: North: Open Space; East: Apartment Parking; South: Shop No. 02; West: Public Road.

**Description of Secured Assets/Immovable Properties:** All that piece and parcel Shop No. 02, admeasuring about 237.00 Sq. Ft. and Shop No. 03, admeasuring about 237.00 Sq. Ft. Carpet area, alongwith undivided share in the land admeasuring about 10.00 Sq. Mtrs. lying and located on the Ground Floor of the Building known as "APPLE APARTMENT" Constructed on the N.A. land bearing Plot No. 39, admeasuring about 1087.00 Sq. Mtrs. bearing Revenue Survey No. 200-291, Pakee bearing City Survey No. 17, Situated within the Village Limits of Vapi/Nagarapalka, Vapi, Taluka Vapi, Dist. Valsad, Gujarat-396111. With common amenities written in Title Document. Shop No. 02-Bounded by: North: Shop No. 03; East: Apartment Parking; South: Shop No. 01; West: Public Road; Shop No. 03-Bounded by: North: Shop No. 04; East: Apartment Parking; South: Shop No. 02; West: Public Road.

Place: Gujarat Sd/- Authorized Officer  
Date: 14-02-2023 For Hero Housing Finance Limited

### Aditya Birla Housing Finance Limited

CORRIGENDUM

A Possession Notice of SARFAESI Act, 2002 was published by Aditya Birla Housing Finance limited against **Yojit Rajankanthbhai Patel**, in Business Standard and Gujarat Newsletters on **13-02-2023** wherein the possession date to be read as **09-02-2023**. Other content of Notice will remain same.

Date : 13.02.2023 Authorized Officer  
Place : Surat Aditya Birla Housing Finance Limited

### Bank of Baroda

APPENDIX-IV (SEE RULE 8(1)) POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

Whereas, the undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated **18-06-2022**, calling upon the Borrower/s, **Mrs. Smitaben Alpeshkumar Chauhan (Borrower), Mr. Alpeshkumar Arunlal Chauhan (Borrower) and Mr. Pravin Kumar Raldevbhai Sathur (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs. 3,36,361.61 (Rupees Three Lakh Thirty-Six Thousand Three Hundred Eighty-One and Paise Sixty-One Only)** as on **18-06-2022** together with further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment within 60 days from the date of receipt of the said notice. The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower and the Public in general that the undersigned has taken **PHYSICAL POSSESSION** of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of the Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002 on this **07th February 2023**.

The Borrower/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Bank of Baroda for an amount of **Rs. 3,36,361.61 (Rupees Three Lakh Thirty-Six Thousand Five Hundred Ninety-Six and Paise Twenty-One Only)** and further interest thereon at the contractual rate plus costs, charges and expenses till date of payment.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Immovable Property**

All that piece and Parcel of residential 112 LG-110-708 of 35.00 Sq. Mtr. Pandit Dindyal Nagar, Somnath Road, situated within the limits of Mehsana, Taluk & District Mehsana having Revenue S.No-1549, North By: Passage and Flat No. 705, East By: Flat No. 707, West By: Staircase, South By: Road

The above property is mortgaged with Bank of Baroda (erstwhile Vijaya Bank) Mehsana Branch through "Memorandum Created by valid registration No. 4013 dated 12/04/2018

Date: 07-02-2023 Chief Manager/Authorized Officer  
Place: Mehsana (Bank of Baroda)

### Agriculture Agriwise Finserv Limited

Registered Office: 601-604, A Wing Banasree, Sector 34, Gandhinagar Metro station, A K Road, Andheri East, Mumbai-400059. Website: <http://www.agriwise.com>, Email: [info@agriwise.com](mailto:info@agriwise.com), Ph: +91-022-4046777, Fax: +91-022-4046778

#### APPENDIX IV (See Rule 8 (1)) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Agriwise Finserv Limited, under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 09-June-2022 calling upon the Borrower/Guarantor/Mortgagor **M/S WOX IMPEX PVT.LTD., UDANRAJ BHARATBHAI ROKAD S/O BHARAT B ROKAD, BHARATKUMAR BAVALAL ROKAD, ANKITA A. PATEL, A/L R/O UDAN SILVER STONE, STREET NO.3,OPP BH BAZAR, 150 FEET RING ROAD, RAJKOT (GUJARAT) - 380005** repay the amount mentioned in the notice being **Rs. 2,31,43,861.99 (Rupees Two Crore Thirty One Lakh Forty Three Thousand Eight Hundred Sixty One And Ninety Nine Paise Only)** due as on 15-05-2022 payable with further interest and expenses until full, within 60 days from the date of receipt of the said notice.

The Borrower's/Guarantor/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrower's/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken physical possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this **09th day of February the year 2023**.

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrower's/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Agriwise Finserv Limited, for an amount being **Rs. 2,31,43,861.99 (Rupees Two Crore Thirty One Lakh Forty Three Thousand Eight Hundred Sixty One And Ninety Nine Paise Only)** due as on 15-05-2022 payable with further interest and expenses until payments/realization in full.

**DESCRIPTION OF IMMOVABLE PROPERTY**

All that Piece and Parcel of Property Residential House on Plot No 6 With Land Adm. 87-16 Sq. Mtr. Area known as "Silver Stone" At Kano Mova Revenue Survey No. 31,322 Pakd, T.P. Scheme No. 3, F.P. No.50/2 Land Adm. 14205-00 Sq. Mtrs. Tal. & Dist. Rajkot and Bounded By: North - Others Property On Plot No. 5, South - Others Property On Plot No. 7, East - Others Property, West - 7.50 Mtr. Road.

Date: 09.02.2023 Authorized Officer  
Place: Rajkot Agriwise Finserv Limited

### RUSHIL DECOR LIMITED

Regd. Office: S. No. 125, Near Kalyanpura Patia, Villi, Tilla, Gandhinagar Mansa Road, Tal. Kalol, Dist. Gandhinagar -382045, Gujarat, India  
Corporate Office: Rushil House, Near Neelkanth Green Bungalov, Off. Sindhu Bhavan Road, Shilaj, Ahmedabad-380058, Gujarat, India.  
Ph. : +91-079-61400400 Fax : +91-079-61400401  
E-mail : [ipo@rushil.com](mailto:ipo@rushil.com) Website : [www.rushil.com](http://www.rushil.com)  
CIN : L25209G1993PLC019532

#### Extract of Unaudited Financial Results for the Quarter and Nine Months ended 31<sup>st</sup> December, 2022

(₹ in lakhs, except per share data)

Particulars	Quarter ended 31.12.2022 (Unaudited)	Nine Months ended 31.12.2022 (Unaudited)	Quarter ended 31.12.2021 (Unaudited)
	Total Income from operations	21030.70	62447.94
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	1341.71	8557.29	978.53
Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	1341.71	8557.29	978.53
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	1023.12	6411.16	728.84
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	1021.27	6405.60	722.90
Equity Share Capital	1990.63	1990.63	1989.96
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	26687.69	26687.69	24441.28
Earnings Per Share (of ₹10/- each) (Not Annualised)			
1. Basic:	5.14	32.21	3.66
2. Diluted:	5.14	32.21	3.66

**NOTE:**  
1) The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full form of the Quarterly Financial Results are available on the Stock Exchange websites viz. [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) and also on the company's website [www.rushil.com](http://www.rushil.com)  
2) Right Issue: During the quarter ended December 31, 2022, the Company has filed the Draft Letter of Offer (DLOF) with Securities and Exchange Board of India (SEBI). SEBI limited (NSE) and National Stock Exchange of India Limited (NSE) on December 29, 2022. Further, the Company has received in principle Approval from SEBI and NSE on January 12, 2023 and January 04, 2023 respectively. Further, on February 02, 2023, the Company has received SEBI Final Observation letter on the Proposed Rights Issue.

For, Rushil Decor Limited  
Krupesh G. Thakkar  
Chairman and Managing Director  
DIN: 01059666

Place: Ahmedabad  
Date: 12<sup>th</sup> February, 2023

# HAVE A GOOD BUSINESS MORNING!

To book your copy,  
SMS reaches to 57575 or email us at [order@bmail.in](mailto:order@bmail.in)

**Business Standard**  
Insight On

f bsindia t bsindia

business-standard.com



# રાષ્ટ્રગીતનું અપમાનિત કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા પોલીસે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી છે

## લગ્ન પ્રસંગે રાષ્ટ્રગીતનું અપમાન કરતા પોલીસે ૧૧ની ધરપકડ કરી

વિડિયો ઉતારનાર અને સોશિયલ મીડિયા પર જાહેર કરનારના નામો હજુપણ અકબંધ: નામ જાહેર થાય તેવી લોકલાગણી ઉભી થઇ છે

ભરૂચ, તા. ૧૩  
દેશની ગરિમાને ભ્રષ્ટ કરવા કેટલાક તત્વો સક્રિય બની પોતાને સુરા પહેલવાન સમજતા હોય છે. ત્યારે ભરૂચમાં રાષ્ટ્રગીતની ગરિમા પર સવાલ ઉઠાવતો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં શેઠના કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીતને અપમાનિત કરતો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રાષ્ટ્રગીતનું મજાક બનાવનાર ૧૧ લોકો સામે બી ડિવિઝન પોલીસે સોશિયલ મીડિયાના આધારે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી મોબાઈલ અને વિડિયો એકઝેસએલ અર્થે મોકલી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં એયુબ



બી ડિવિઝન પોલીસે વાયરલ વિડિયોના આધારે વીડિયોમાં દેખાતા અને જેની દીકરીના લગ્ન હતા તેવા (૧) જુબેર ઈસ્માઈલ પટેલ રહે, પંજરા હોટલ, મસ્જીદની બાજુમાં મહંમદપુરા ભરૂચ (૨) સલીમ અબ્દુલ વીરા રહે, નાના નાગોરીવાડ

**વીડિયોમાં દેખાતા શખ્સનું ભાજપ કનેક્શન હોવાનું જગ જાહેર છે**  
વાયરલ વિડિયોમાં ઈમરાન ખંજરા નામનો શખ્સ પણ સ્થળ પર હાજર હોય અને રાષ્ટ્રગીતનું અપમાન કરતો હોય સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઈમરાન ખંજરા પોતે ભાજપના નેતાઓ સાથે સીધું કનેક્શન ધરાવતા હોવાનું જગ જાહેર છે. આ બાબતે ઈમરાન ખંજરા સહિતના લોકો પર કાર્યવાહી થશે ખરી કે પછી કોઈપણ કાર્યવાહી અવશે? હાલ તો દેશની કરોડો જનતાની લાગણી દુભાઈ રોકીયા રહે, મસ્જીદની સામે, મહંમદપુરા ભરૂચ (૩) ઈરફાન મુબારક પટેલ રહે, દાદાભાઈ મેન્સન, મોહમદપુરા ભરૂચ (૪) નાસીર ઈસ્માઈલ સમીનીવાલા રહે, બદરપારક ભરૂચ (૫) વસીમ શબ્બીરભાઈ નવાબ રહે, લાકડાવાલા કોમ્પ્લેક્સ મહંમદપુરા ભરૂચ (૬) રુહીકાર પટેલ રહે, લકી મેન્સન મહંમદપુરા ભરૂચ (૭) ઈમરાન મુસા પટેલ રહે, મોહમદપુરા મસ્જીદની બાજુમાં ભરૂચ, (૧૨) એયુબ ઈબ્રાહીમ પટેલ રહે, સીટીઝન કોમ્પ્લેક્સ મહંમદપુરા ભરૂચની અટકાયત કરવામાં આવી હતી. જોકે વાયરલ વિડિયોમાં ૧૨ શખ્સો નજરે પડી રહ્યા છે સાથે જ વિડિયો ઉતારનાર,

**સઈદ રોકડીયા ભાજપમાંથી નગરપાલિકાની ચૂંટણી લડવા હતા**  
રાષ્ટ્રગીતનું અપમાનિત કરતો વિડિયો બનાવનારમાં એક સઈદ રોકડીયા ભરૂચ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૧ માંથી ભાજપમાંથી ચૂંટણી લડવા હતા. તેઓએ જ રાષ્ટ્રગીતનું અપમાનિત કરતા વીડિયોમાં તેઓ દેખાતા ભાજપની છબી પણ ખરડાઈ રહી હોય તેવી ચર્ચાઓ એ ભારે જોડ પકડ્યું છે. રાષ્ટ્રગીતને અપમાનિત કરતો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ પોલીસે વીડિયોમાં દેખાતા ૧૧ લોકોની પોલીસ મથકે લાવી પુછપ રછ કરી હતી અને વિડિયો તેમણે બનાવ્યો હોવાની કબુલાત કરી હતી અને ગત રાત્રીએ જ વિડિયો બનાવ્યો હોવાની જાણવાજોગ ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે. વિડિયો પોતે બનાવ્યો છે તેવી કબુલાત કરાય તો શું પોલીસ પ્રશ્ન દ્રષ્ટિએ ગુનો દાખલ કરતો જોઈએ તેવી લોકચર્ચા ચાલી હતી. હાલ તો પોલીસે મોબાઈલ અને વિડિયો અને એકઝેસએલ અર્થે મોકલી રિપોર્ટ આપ્યા બાદ ગુનો દાખલ કરવામાં આવનાર હોવાનું રટણ કરી રહ્યા છે.

**Banco Products (India) Limited**  
Bill, Near Bhaili Railway Station, Padra Road, Dist. Baroda - 391 410  
Phone No. (0265) 2318226  
E-Mail: investor@bancoindia.com • Website: www.bancoindia.com  
CIN : L51100GJ1961PLC001039

**NOTICE**  
Notice is hereby given that in terms of applicable provisions of the Companies Act, 2013 and the Listing Regulations, the Company has fixed Shareholders entitled to receive the Interim Dividend, for the financial year ending on 31.03.2023 declared by the Board of Directors at their meeting held on 13.02.2023.

**TDS on Dividend:**  
In accordance with the prevailing provisions of the Income Tax Act, 1961, the Company would be required to deduct tax at source ("TDS") at the prescribed rates on the dividend paid to its shareholders after 1st April, 2020. The TDS rate would vary depending on the residential status of the shareholder and the documents submitted by them and accepted by the Company. Therefore, the members are requested to update their PAN and upload applicable documents, to avoid deduction of tax at higher rate by complying with the process mentioned hereunder or by way of email to the Company or its /Registrar and Transfer Agents as per the Email Ids provided.

Members are requested to visit the website of the Company's Registrar & Share Transfer Agent, Link Intime India Pvt. Limited ("LIPL") to upload the applicable documents such as Form 15G/15H, documents u/s. 196, 197A, FPI Registration Certificate, Tax Residency Certificate, Lower Tax Certificate and upload applicable documents such as Form 15G/15H, documents u/s. 196, 197A, FPI Registration Certificate, Tax Residency Certificate, Lower Tax Certificate at <https://web.linkintime.co.in/formsreg/submission-of-form-15g-15h.html> latest by 25th February, 2023 in order to enable the Company to determine the appropriate TDS / withholding tax rate applicable.

Non Resident Indians (NRI) are requested to download and open in Acrobat Reader the form of Indian Withholding Tax declaration for F.Y. 2022-23 from the link at - <http://mail.bancoindia.com/upload/form-indian-withholding-tax-declaration.pdf> and shall submit the same to the Company by way of email to the Company at [taxation@bancoindia.com](mailto:taxation@bancoindia.com), [investor@bancoindia.com](mailto:investor@bancoindia.com) and [sec@bancoindia.com](mailto:sec@bancoindia.com) or its Registrar and Transfer Agents as per the Email Ids provided in addition to their Tax Residency Certificate latest by 25th February, 2023.

Further this notice is available on website of the Company i.e [www.bancoindia.com](http://www.bancoindia.com) and website of stock exchanges i.e [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com).

Place : Bil Sd/-  
Date : 13.02.2023 Director

### અગાઉ યોજાયેલી તમામ આવૃત્તિની તુલનામાં સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો

**કોમોડિટી માર્કેટ પર રાષ્ટ્રીય સ્તરની 'કવીઝ કોમ્પેસ્ટ' -૨૦૨૩ યોજાઈ**

આ વર્ષની સ્પર્ધામાં આ અગાઉ યોજાયેલી તમામ આવૃત્તિની તુલનામાં સૌથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 'એમસીએક્સ-આઈપીએફ કોમ્પેસ્ટ' - ૨૦૨૩ કવીઝનો શ્રાવણ કિનાલે મુંબઈમાં વિવે પાર્લે સ્થિત પ્રતિષ્ઠિત એસ.પી. જૈન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ખાતે યોજવામાં આવ્યો હતો. એમસીએક્સ-આઈપીએફ કોમ્પેસ્ટ એ ભારતની કંપનીઓના ભવિષ્યના લીડર્સ એવા યુવાનો અને વિદ્યાર્થીઓમાં કોમોડિટી બજારો વિશે જ્ઞાન અને જાગૃત્તા લાવવાના હેતુ સાથે વર્ષ ૨૦૧૯માં માર્ગ નામ અપસાનાલીની મેયુલિયા બીન મહમ્મદમિયાં મલેક ત્રિપાથી શાહીનબાનુ મોહમ્મદમુનાફ શેખ કરેલ છે. નવાપુરા, વાડી, વડોદરા

**વડોદરા મહાનગરપાલિકા**  
www.vmc.gov.in  
જાહેર નોટીસ

આથી વડોદરા શહેરના નાગરિકોને સૂચના આપવામાં આવે છે કે, સહાયક ગંગા વિસ્તારમાં આવેલ કક્ક બજાર (શાક માર્કેટ)થી રેલ્વે સ્ટેશનને ખેડતો ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ કરવો હિતાવહ નથી. જાહેર સલામતીને ધ્યાને લઈ સદર રૂઝ ઓવર બ્રિજ જાહેર જનતાના વપરાશ માટે બંધ કરવામાં આવેલ છે. જેની સૌંદર્ય એ નોંધ લેવી.

પી.આર.ઓ.નં.૧૦૨૭/૨૦૨૨-૨૩ કાર્યપાલક ઈજનેર (રોડ પ્રોજેક્ટ)

**Bharat Parenterals Limited**  
CIN NO: L24231GJ1992PLC018237  
Registered Office & Works: V. Haripura, Ta. Savli, Dist. Vadodara - 391520 (Guj.) India.  
Tel : (02667)-251679, 251680, 251669, 99099 28332.  
E-mail: info@bplindia.in, Web: www.bplindia.in  
(WHO-GMP CERTIFIED • STAR EXPORT HOUSE)

**EXTRACT OF UNAUDITED FINANCIAL RESULT FOR THE QUARTER AND HALF YEAR ENDED 31st DECEMBER, 2022**  
(Rs. in lakhs)

Sr. No.	Particulars	STANDALONE			CONSOLIDATED			Year Ended 31.03.2022 (Audited)
		Quarter Ended 31.12.2022 (Unaudited)	Quarter Ended 30.09.2022 (Unaudited)	Quarter Ended 31.12.2021 (Unaudited)	Quarter Ended 31.12.2022 (Unaudited)	Quarter Ended 30.09.2022 (Unaudited)	Quarter Ended 31.12.2021 (Unaudited)	
1.	Total Income from operations (net)	5902	8190	3846	5902	8190	3846	21201
2.	Net Profit for the period before tax	524	1394	235	390	1379	215	2788
3.	Net Profit for the period after tax	381	999	145	247	984	125	2081
4.	Total Comprehensive Income for the period	375	993	149	242	979	129	2058
5.	Equity Share Capital	577.466	577.466	572.96	577.466	577.466	572.96	577.466
6.	EPS Basic & Diluted	6.60	17.30	2.55	4.94	17.19	2.32	36.67

**NOTE:**  
1) The above Results has been reviewed by Statutory Auditors, recommended by Audit Committee and approved by the Board of Directors of the Company at its meeting held on 13<sup>th</sup> February, 2023.  
2) The above is an extract of the detailed format of quarter/ financial results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter and half year ended 31st December, 2022 are available on the websites of the stock exchange www.bseindia.com and also on Company's Website www.bplindia.in

By order of the Board  
For Bharat Parenterals Limited Sd/-  
BHARAT R DESAI  
Managing Director

Place : Vadodara Sd/-  
Date : 13th February, 2023

**Ajwa Fun World & Resort Limited**  
Regd. Office : Ajwa-Nimeta Road, P.O.: Ajwa Compound-391510, Tal : Waghadia, Dist : Baroda. (Gujarat) CIN : L45201GJ1992PLC018294

**STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED ON 31ST DECEMBER, 2022**  
(Rs. In Lacs except per share data)

SR NO	PARTICULARS	Quarter Ended		Nine Month Ended		Year Ended
		31.12.22	30.09.22	31.12.21	31.12.21	
1	Income					
	Revenue from Operations	111.03	10.95	17.32	248.11	32.36
	(a) Total Revenue from Operation	111.03	10.95	17.32	248.11	32.36
	(b) Other Operating Income	0.96	2.91	0.18	5.23	0.94
	Total Income (a+b)	111.99	13.86	17.50	253.34	33.30
2	Expenses					
	(a) Cost of Materials consumed					
	(b) Purchase of Traded Goods	75.45	1.38	3.30	90.27	7.26
	(c) Change in Inventories of finished goods, work-in-progress and stock - in - trade					
	(d) Employee benefit expenses	16.67	14.94	14.27	51.19	35.58
	(e) Finance costs	1.96	2.71	0.73	6.66	3.87
	(f) Depreciation and amortisation expenses	6.80	6.80	6.80	20.40	20.40
	(g) Other expense	17.97	14.63	32.11	64.94	53.89
	Total Expenses	118.85	40.46	57.21	233.46	121.00
3	Profit / loss from operations before exceptional and Extra Ordinary Item & Tax (1 - 2)	(6.86)	(26.60)	(39.71)	19.88	(87.70)
4	Exceptional Items - Expenditure / (Income)					
5	Profit / (Loss) from ordinary activities before Extra Ordinary Items & Tax (3 ± 4)	(6.86)	(26.60)	(39.71)	19.88	(87.70)
6	Extraordinary Items	0.00	0.00	0.00	0.00	0.00
7	Profit / (Loss) before Tax (5 ± 6)	(6.86)	(26.60)	(39.71)	19.88	(87.70)
8	Tax Expenses:					
	(1) Current Tax					
	(2) Deferred Tax					
9	Profit / (Loss) for the period (7 ± 8)	(6.86)	(26.60)	(39.71)	19.88	(87.70)
10	Other Comprehensive Income (After Tax)					
11	Total Comprehensive Income (9 ± 10)	(6.86)	(26.60)	(39.71)	19.88	(87.70)
12	Paid-up Equity Share Capital (Face Value Rs. 10/- each)	639	639	639	639	639
13	Earning Per Share (after extraordinary items - not annualised)					
	(a) Basic	(0.11)	(0.42)	(0.62)	0.31	(1.37)
	(b) Diluted					

**NOTE:** (01) The Company opts to publish the quarterly and Nine months financial results on standalone basis. (02) The unaudited financial results of the company for the quarter and nine months ended 31st December, 2022 duly reviewed by the Audit Committee have been approved by the Board of Directors at its meetings held. (03) Result for the quarter and Nine Month ended 31st December 2022 are in compliance with Indian Accounting Standards (Ind-AS) notified by the Ministry of Corporate Affairs. Consequently, result for the quarter and Half year ended 30th September 2022 have been restated to comply with Ind-AS to make them comparable. (04) As the Company's business activities fall within a single primary business segment viz "Entertainment & Accommodation" the disclosure requirements of Ind-AS 108 "Operating Segment" prescribed under Section 133 of Companies Act, 2013 read with relevant rules issued thereunder are not applicable. (05) As per the requirements of Ind-AS 12, there is no deferred tax liability on the company. On Account of unabsorbed depreciation and carry forward of losses under tax laws, deferred tax assets are not recognized in view of uncertainty that such deferred tax assets can be realised against future taxable profits. (06) No Investor complaint was pending at the beginning of the quarter. During the quarter, No complaint received. Investor may send their complaint/grievance through email at: [investorcomplaints@gmail.com](mailto:investorcomplaints@gmail.com) with facts of the case, if any. (07) The Audit Committee reviewed the above results. The Board of Directors in their approved the above results and its release. Limited Review of the unaudited financial year ended on 31st December, 2022 has been carried out by the Statutory Auditors. And Half year ended 30th September, 2022 had not been audited/reviewed and information compiled by the management after making necessary adjustments to in accordance with Ind-AS.

PLACE: BARODA BY ORDER OF THE BOARD OF DIRECTORS RAJESH C. JAIN  
DATE : 13-02-2023 OF AJWA FUN WORLD & RESORT LIMITED MANAGING DIRECTOR  
DIN: 02285542

**BANCO PRODUCTS (INDIA) LIMITED**  
Regd. Office : Bil, Near Bhaili Rly. Station, Padra Road, Dist. Vadodara - 391 410. Phone : (0265) 2318226  
CIN NO:- L51100GJ1961PLC001039, Website :- www.bancoindia.com, E-mail:- investor@bancoindia.com

**EXTRACT OF STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2022**  
(Rs. in Lakhs)

Particulars	Standalone					Consolidated					
	Quarter ended 31.12.2022 (Unaudited)	Quarter ended 30.09.2022 (Unaudited)	Quarter ended 31.12.2021 (Unaudited)	Nice Months ended 31.12.2022 (Unaudited)	Nine Months ended 31.12.2021 (Unaudited)	Previous Year ended 31.03.2022 (Unaudited)	Quarter ended 31.12.2022 (Unaudited)	Quarter ended 30.09.2022 (Unaudited)	Quarter ended 31.12.2021 (Unaudited)	Nine Months ended 31.12.2021 (Unaudited)	Previous Year ended 31.03.2022 (Audited)
Total income from Operations	24,502	37,056	19,256	86,973	59,484	82,442	51,029	63,807	39,974	173,518	145,703
Net profit /(loss) for the period (before tax, exceptional and/or extra ordinary items)	4,403	14,254	2,058	22,787	8,278	11,000	12,581	5,630	2,827	23,674	17,125
Net profit /(loss) for the period before tax (after exceptional and/or extra ordinary items)	4,403	14,254	2,058	22,787	8,278	11,000	12,581	5,630	2,827	23,674	17,125
Net profit /(loss) for the period after tax (after exceptional and/or extra ordinary items)	3,202	13,385	1,501	20,063	6,556	8,566	9,823	5,173	1,710	18,455	11,223
Total Comprehensive Income for the period (Comprising Profit/(Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	3,202	13,381	1,501	20,059	6,545	8,454	7,576	5,347	1,942	16,782	12,835
Equity Share Capital	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430	1,430
Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year).	Rs.67,059/-Lakhs as on 31st March 2022					Rs.96,687/-Lakhs as on 31st March 2022					
Earning per share (of Rs. 2/- each) (for continuing and discontinuing operations)-											
Basic	4.62	18.72	2.10	28.05	9.31	11.98	13.73	7.23	2.39	25.80	15.69
Diluted	4.62	18.72	2.10	28.05	9.31	11.98	13.73	7.23	2.39	25.80	15.69

**Note:** (1) The above is an extract of the detailed format of the Unaudited Financial Results of the Company for the Quarter and Nine Months ended 31st December, 2022 filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter and Nine Months ended on 31st December, 2022 are available on the website of BSE Limited at [www.bseindia.com](http://www.bseindia.com), National Stock Exchange of India Limited at [www.nseindia.com](http://www.nseindia.com) and on the website of the Company at [www.bancoindia.com](http://www.bancoindia.com). (2) The above results (Standalone and Consolidated) have been prepared in accordance with Indian Accounting Standards ("IND AS") notified under section 133 of the companies Act 2013, read together with relevant rules issued there under and other accounting principles generally accepted in India.

Place : Vadodara Sd/-  
Date : 13.02.2023

For Banco Products (India) Limited  
(Mehul K. Patel)  
Chairman